

## બાળસહજ રસીલાં ગીતો એટલે ‘શૈશવનાં શમણાં’ | નટવર પટેલ

શૈશવનાં શમણાં : કવિ વિનોદ જાની, પ્રકાશક : રન્નાડે પ્રકાશન, પ્ર. આ. ૨૦૦૭, પૃ. ૪૬+૧૦  
ડબલ કાઉન, ડિ. ૩. ૫૫/-]

અહીં કવિ વિનોદ જાનીએ રૂપ બાળરચનાઓ આપી છે. અહીં નાનાં બાળકોને (૧૦ વર્ષથી નાનાં) રસ પડે તેવીય રચનાઓ છે, તો મોટાભાગની રચનાઓ કિશોરવયનાં બાળકો માટેની છે.

આ સંગ્રહનાં કાચ્યો પર નજર કરતાં તેમાં રહેલું વિષયવૈવિધ્ય ઊરીને આંખે વળ્ગે છે. કવિ બાળમનોવિશાનના અભ્યાસી હોય તેવું આ કાચ્યો વાંચતાં અનુભવાય છે. કવિ વ્યવસાયે શિક્ષક છે એટલે બાળસહજ વિષયો એમને હાથવગા છે. અહીં કવિએ ચાંદલિયાને વાણીઓ સંગે રમતો દર્શાવ્યો છે, તો ચકલીને ચી...ચી કરતી ઊરી ઊડાડી કરતી ચીતરી છે. કાગડો થઈ જતી છલીલ નામના બાળકની છઠીની પણ અહીં મજા છે. ભૂલકાંઓની છુક છુક ગાડી પણ ખરી. ચોમાસું પૂરું થતું સંતાઈ જતો દેડકો પણ અહીં છે. રંગબેરંગી મોરલો કવિના ખેતરમાં કળા કરતો પણ દેખાય છે.

કાચ્યોમાં કવિ શૈશવની મસ્તી લઈ આવ્યા છે. મસ્તીખરી આ રહી કેટલીક પંક્તિઓ :

રમત જામી છે વાદળ-ચાંદાની

સંતાકૂકડી એ ખેલે મજાની

મીટ માંતી ગગનને જોવું ગમે...

(ચાંદલિયો)

ખેતરના માળે હું બેસી નીરખતો

કેવી અદાથી તું ગુમતો જી રે.

(ખોરલો)

કરવાનું ના લેશન

ભાઈ, પડી ગયું વેકેશન.

(વેકેશન)

હાલ ભરી વાણી તારી

મા ! તું લાગે હાલી હાલી.

(લાગે હાલી હાલી)

રિસેસનો ઘંટ વાગ્યો રે દોસ્તો

ચાલો મેદાનમાં જઈએ રે.

(શાળાની)

રિસેસ)

ઉત્તમ બાળકાચ્ય કોને કહીશું ? પહેલી શરત એ કે તે બાળકને ગમી જાય. એ વારંવાર વાંચવા ને ગણગણવા પ્રેરાય. ક્યારેક એવું પણ બને કે આજી રચના ઉત્તમ ન બને પરંતુ એની થોડીક પંક્તિઓ ઘણી સુંદર હોય. બાળકાચ્યની પંક્તિઓ નાની હોય, લય-પ્રાસ જળવાયા હોય, બાળકને જરૂર સમજાઈ જાય એવા શબ્દો ગુંથાયા હોય તો એ રચના વિશે બાળવાચ્યને જાહેરી ફરીયાદ રહેતી નથી.

‘ચકલી’ કાચ્યની આ પંક્તિઓ જુઓ :

‘દેડતાં ઊરીં ચકલી બોલે ચી ચી ચી  
બચ્યાંઓ પણ સાથે બોલે ચી ચી ચી’

‘દેડકો’ કાચ્ય પણ આ રીતે જોતાં સરસ બન્યું છે. કવિએ દેડકાની વાત કાચ્યમય શૈલીમાં સહજ રીતે કરી છે. અહીં અંત્યાનુપ્રાસ પણ સરસ જળવાયા છે :

વર્ષાની જ્યાં વરસે ધાર,  
તરત દેડકાં આવે બહાર.

S

પાછળના બે મોટા પગ,  
કૂદક મારી ભરતો ડગ.

અહીં કવિએ બાળસહજ જિશાસાને પણ સરસ રીતે નિરૂપી છે. ચોમાસું પૂરું થતાં દેડકાં જ્યાં જતાં હશે ?

ચોમાસું જ્યાં પૂરું થાય  
જઈને કયાં છુપાઈ જાય !

(દેડકો)

અહીં કવિએ દેડકાં ધરતીમાં જઈને છુપાઈ જાય છે એ હકીકત વણી લીધી હોત તો રચના સાંદ્રેત ઉત્તમ બની રહેત. મોરના રંગો વિશેની આ કવિ-કલ્યના જુઓ :

કોની સાથે અલ્યા ! હોળી ખેલી તે

રંગાઈ ગઈ તારી કાચા જી રે.

(ખોરલો)

કેટલીક રચનાઓમાં કવિ અંત્યાનુપ્રાસ જાળવી શક્યા નથી. પ્રાસ તૂટતાં ક્યારેક લય પણ ખોડંગાય છે. ‘સ્ટેશન’ કાચ્યની આ પંક્તિઓ જુઓ :

‘ભીડથી ઉભારાયે સ્ટેશન  
સુખ અને દુંગ જોતું સ્ટેશન.’

‘પંતંગનો ઉત્સવ’ રચનામાં કવિએ ચાર-ચાર પંક્તિઓના અંતરા પાડ્યા છે, જેમાં ચોથી પંક્તિ પ્રથમ પંક્તિ સાથે પ્રાસ જાળતે એ પ્રકારની આ રચના છે. એમાં છેલ્લી ટૂંકમાં આ બંધારણ જળવાતું નથી.. આ જુઓ :

‘ધીમે ધીમે સૂરજ પશ્ચિમમાં દૂલતો,  
મંદ મંદ હેરાનીથી, વાયુ સૌને ચૂમતો,  
ગાન્ધીએ લેળું થૈ આવાને બેસે  
ગોંધિયું-જલેલી મોજથી જે.

આજનો તહેવાર અલ્યા કોને ન ગમે ?’

પ્રથમ ત્રણ પંક્તિના અંત્યાનુપ્રાસ જાળવવા ‘ધેસે’ને સ્થાને ‘ધેસ્તો’ શબ્દ હોવો ઘટે. ક્યારેક કવિમાં શિક્ષક-આત્મા પ્રવેશી જાય છે ને બાળકને સીધો ઉપદેશ પણ આપી બેસે છે. આ જુઓ :

જાવન જીવતા બધા આપણે  
લાગે છે ન સરકસ જેંબું.

(સરકસ)

ગુલાબજળ - ગુલક્કદ આપીને કહી રહ્યું ગુલાબ

‘કાંટામાં રહીને પણ દેજો હસ્તીને મધુર સુવાસ.’ (ગુલાબ)

બાળકોના મનમાં પાપ અને પુષ્ય અંગેના કેવા ખ્યાલો હો ? પ્રથમ સવાલ એ છે કે એવા ખ્યાલ હોય છે ખરા ? સત્ય અને અસત્ય વિશે પણ બાળકમન કરી સમજતું નથી. બાળકના મુખે પ્રાર્થનામાં આ શબ્દો કેટલા જચશે ? કવિએ ‘પ્રાર્થના’ નામક રચનામાં પાપ વિશે વાત કરતાં બાળમુજે કહેવરાવું છે કે –

‘અજાણતાં કે કેટલાં નિશાદિન થાયે પાપ,

દીન-દ્યાળુ હે પ્રભુ ! એ સૌ કરજે માફુઃ’

કવિ દલપત્રરામના ‘ઓ ઈશ્વર ભજ્યે તને...’ નામના કાવ્યમાં એક પંડિત કરીક આવી છે : ‘ભૂલ કરીએ અમે, તો પ્રભુ કરજે માફુઃ’ અહીં ‘ભૂલ’ શબ્દની સંકલ્પના બાળકના ગળે કદાચ ઉત્તારી શકાશે, પરંતુ ‘પાપ’ અંગેની એટલી જ સ્પષ્ટતાથી વાત થઈ શકશે કે કેમ ? એવો પ્રશ્ન અહીં મને તો થાય છે.

અહીં કેટલાંક પ્રસંગ-કાવ્યો સારાં બન્યાં છે. બાળકોને એવાં કાવ્યો વાંચવામાં અને સમજવામાં સરળતા રહે છે. ‘છબીલની છત્રી’, ‘સરકસ’, ‘ફેરિયો’ વગેરે આવાં કાવ્યો છે.

અહીં કેટલીક રચનાઓમાં ક્યાંક ક્યાંક બાળકોને ન સમજાય એવી અસ્પષ્ટ ભાવવાળી પંડિતાઓ પણ છે. આવી પંડિતાઓ ટાળી શકાઈ હોત અથવા અલગ ભાવથી રજૂ થઈ હોત તો જે-તે રચના ઉત્તમ બની રહેત. કેટલાંક ઉદાહરણ જોઈએ :

‘ગુરુ-શિષ્યનો કેવો સંબંધ છે !

વાળન કરાય ના એ મોટો નિબંધ છે,

ચાલો વધારીએ શાન.

(મારી શાળા)

S

પણ્ણાએ વસાણું આઘ્યું,

પસ્તાવાનું હાણું વાયું.

(દીવી)

S

બધી ઋતુમાં ગમે શિયાળો

લોક કહે એને સહિયારો !

(શિયાળો)

શિયાળો કરી રીતે સહિયારો તે વાત અહીં અસ્પષ્ટ છે.

આ સંગ્રહમાં ‘ફેરિયો’ કાવ્ય એ હિન્દી કવિતા – ‘ખુદા કી અકલમન્દી’ના ભાવાનુવાદવાળી રચના છે, જે હિન્દી રચના જેવી ઉત્તમ બની નથી. પુસ્તકનું નામ છે ‘શૈશવનાં શમકણાં’ ને પુસ્તકમાં રૂતમી રચનાનું નામ છે ‘શૈશવનાં સપનાં.’ આ રચના પરથી જ આ સંગ્રહનું નામ રાખ્યું હોય એવું લાગે છે. તેથી બને શીર્ષક સરખાં હોવાં જોઈએ, જે અહીં નથી. તો વળી, કેટલાક શબ્દો જેવા કે – બખ્તર, અધર, કંકણ, સિદ્ધિ વગેરે બાળવાચકોને સમજવા અધરા પડે તેવા છે.

એકદરે મોટાભાગની રચનાઓ બાળજોગ્ય બની છે. કવિએ બાળકોને ઉજાણી કરાવી છે, એનો હરખ વ્યક્ત કરી કવિને અભિનંદન પાઠવી વિરમું છું.